https://archive.org/details/bk1142/page/n0/mode/1up

1944 to 1955 Between -Mathal -Stop giving Dasond Money to Pirana (1142)

All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

શ્રી કચ્છ કડવા પાટીદાર ભાઈયો ને

શ્રી મથલ સંસ્થા તરફ થી બે બોલ.

પ્રીય જ્ઞાન્તી બંધુઓ આપથી કડવા પાટીદાર જેવી ઉચ્ચ જ્ઞાન્તીએ પીરાણાં પંથ જરાપણ સોભતો નથી માટે સૈયદો એ પોતાના સ્વાર્થ સાધવા માટે આ. પીરાણાં પંથનો પ્રચાર કર્યો છે. માટે આપને સમજવુ જોઈએ કે આપણા પરસેવાના રક્ત બીન્દુ ટપકપી ભેગી કરેલી સ્વકમાઈ ના નાંણા માથી ધર્માદાનું નામ પાડી કાકા અને સૈયદો ને આપીએ છીએ તેજ નાંણા માથી પાપીઓ આપણને ભ્રષ્ટ કરવાની બાજીઓ રચે છે તે નાણામાંથી એક ત્રાંબીઓ પણ કુપાત્રને પીરાણે મોકલવો નહિ- આપણાજ દાન થી તે પાપી મોજે ઊડાવો છે.

આપણા દાન થી કાકા, મજા મજો ઉડાવે છે.
આપણા દાન થી સૈયદો. હજારાં જીવ કાપે છે.

માટે પીાણે હુડી નાં મોકલતાં આપણી જ્ઞાન્તી માં ગરીબ બંધુ તથા નીરાધાર વીધવાઓ અને ગરીબના બાળકો ના ચોથરે હાલ જેવામાં આવે છે. અહહા વખતના અનુસારે બીચારાં ને પેટ પુરતું અન્ન મળવાના સાંસા પડેછે પરંતુ ધરમાદા ની ને નાણાં માંથી ગરીબો ને મદદ આપી આધાર કરવા માં શુ પુન ઓછુ છે. વાઢાય દવારા નાં સાધુ દયાલદાસજી એ આપણી જ્ઞાન્તી ની શેવા તન ને મન થી બજાવે છે અને આપણી જ્ઞાન્તી ના અંધ સુરદાસ બાળકો ને પાલન પોષણ તથા વિદ્યા અભ્યાસ કરાવે છે તો તેવા આશ્રમો ને આધાર ટરવો ને ગામો ગામ-સંસ્થાઓ ખોલી ધાર્મીક પુસ્તકો વસાવો જેથી આપની જ્ઞાન્તી નો ભાગ્ય ઉદય થાય- અત્યારે ગામ વાઢાય માં ગામ શ્રી મથના હાલમાં સુખ નીવાસ ગુજરાત માં મોતીસરી ના પટેલ હરજી કરમશી એ હાલમાં આપની કુળદેવી ઉમીયાં માતાજીનું મંદીર બંધાવ્યું છે તો તેવીજ લાગણી આપ સર્વે જ્ઞાન્તી ભાઈયોને હોવી જોઈએ અને પીરાણે જતો પૈસો બંધ કરી આપની જ્ઞાન્તી મે અર્થે પૈસા વાપરવા આપ સરવે ભાઈયોને અમારી નમ્ર પ્રાથના છે.

લી૦ સેવકો
પાટીદાર પટેલ ખીમજી નાગજી
" " વાલજી કાનજી
" " હંસરાજ દેવજી
" " પચાણ પેથા
પ્રણામ સ્વીકારશોજી

શ્રી પ્રકાશ પ્રિં૦ વર્કસ ૫૭ ગાડોદિયા માર્કેટ દેહલી મેં છપા.

realpatidar.com

https://archive.org/details/bk1142/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

https://archive.org/details/bk1142/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.20 18:18:20 +05'30'

realpatidar.com

શ્રી કચ્છ કડવા પાટીદાર ભાઈયો ને

શ્રી મથલ સંસ્થા તરફ થી બે બોલ.

પ્રીય જ્ઞાન્તી બંધુઓ આપથી કડવા પાટીદાર જેવો ઉચ્ચ જ્ઞાન્તીએ પીરાણાં પંથ જરાપણ સોભતો નથી માટે સૈયદો એ પોતાના સ્વાર્થ સાધવા માટે આ. પીરાણાં પંથનો પ્રચાર કર્યો છે. માટે આપને સમજવુ જોઈએ કે આપણા પરસેવાના રક્ત બીન્દુ ટપકપી ભેગી કરેલી સ્વકમાઈ ના નાંણા માથી ધર્માદાનું નામ પાડીં કાકા અને સૈયદો ને આપીએ છીએ તેજ નાંણા માથી પાપીઓ આપણને ભ્રષ્ટ કરવાનો બાજીઓ રચે છે તે નાણામાંથી એક ત્રાબીઓ પણ કુપાત્રને પીરાણે મોકલવો નહિ - આપણાજ દાન થી તે પાપી મોજે ઊડાવે છે.

આપણા દાન થી કાકા, મજા મજો ઉડાવે છે.
આપણા દાન થી સૈયદો. હજારો જીવ કાપે છે.

માટે પીાણે હુડી નાં મોકલતાં આપણી જ્ઞાન્તી માં ગરીબ બંધુ તથા નીરાધાર વીધવાઓ અને ગરીબના બાળકો ના ચોથરે હાલ જોવામાં આવે છે. અહહા વખતના અનુસારે બીચારાં ને પેટ પુરતું અન્ન મળવાના સાંસા પડેછે પરંતુ ધરમાદા ની ને નાણાં માંથી ગરીબો ને મદદ આપી આધાર કરવા માં શુ પુન ઓછુ છે. વાઢાય દવારા નાં સાધુ દયાલદાસજી એ આપણી જ્ઞાન્તી ની શેવા તન ને મન થી બજાવે છે અને આપણી જ્ઞાન્તી ના અંધ સુરદાસ બાળકો ને પાલન પોષણ તથા વિદ્યા અભ્યાસ કરાવે છે તો તેવા આશ્રમો ને આધાર ટરવો ને ગામો ગામ-સંસ્થાઓ ખોલી ધાર્મીક પુસ્તકો વસાવો જેથી આપનો જ્ઞાન્તી નો ભાગ્ય ઉદય થાય - અત્યારે ગામ વાઢાય માં ગામ શ્રી મથના હાલમાં સુખ નીવાસ ગુજરાત માં મોતીસરી ના પટેલ હરજી કરમશી એ હાલમાં આપની કુળદેવી ઉમીયાં માતાજીનું મંદીર બંધાવ્યું છે તો તેવીજ લાગણી આપ સર્વે જ્ઞાન્તી ભાઈયોને હોવી જોઈએ અને પીરાણે જતો પૈસો બંધ કરી આપની જ્ઞાન્તી મે અર્થે પૈસા વાપરવા આપ સરવે ભાઈયોને અમારી નમ્ર પ્રાથના છે.

લી૦ સેવકો
પાટીદાર પટેલ ખીમજી નાગજી
" " વાલજી કાનજી
" " હંસરાજ દેવજી
" " પચાણ પેથા
પ્રણામ સ્વીકારશોજી

શ્રી પ્રકાશ પ્રિં૦ વર્કસ ૫૭ ગાડોદિયા માર્કેટ દેહલી મેં છપા.

realpatidar.com